

LL.B. Semester - 3 (CBCS) Examination
Oct/Nov - 2022 [NEW COURSE]
Principles of Taxation Law & GST(Core)

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ આવકવેરા સત્તાવાળા વિશે સવિસ્તાર ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૧ આવક એટલે શું? કુલ આવકમાં કઈ - કઈ આવકોનો સમાવેશ થાય છે?
- પ્રશ્ન.૨ માલ અને સેવા અધિનિયમ અંતર્ગત નોંધણી વિગતવાર સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૨ માલ અને સેવાકર અધિનિયમ હેઠળ કરના પ્રકારોની ચર્ચા કરો.
- પ્રશ્ન.૩ લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૩ પૂરવઠાનો વ્યાપ સમજાવી, ખાસ અને મિશ્ર પૂરવઠા વિશે ચર્ચા કરો.
- પ્રશ્ન.૪ ફૂલ આવકની ગણતરીમાંથી પ્રાપ્ત થતી કપાતો સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૪ આવકની ગણતરી વખતે ક્યા-ક્યા ખર્ચાઓ, રાહતો અને અપવાદો મજરે મળી શકે છે?
- પ્રશ્ન.૫ આપેલ પૈકી કોઈ બે વિશે ટૂંકનોંધ લખો. (૧૪)
1. માલ અને સેવાકર અધિનિયમ હેઠળ વેરા ભરતિયું
 2. આવકવેરા કાયદા હેઠળ આકારણી
 3. ઇ-કોમર્સ
 4. આવકવેરા કાયદા હેઠળ મૂળમાંથી કપાત

ENGLISH VERSION

- Q.1 Discuss in details about the Income tax authorities. (14)
 OR
- Q.1 What is Income? Which incomes are included in Total Income?
- Q.2 Explain "Registration" under Goods and Service Tax. (14)
 OR
- Q.2 Discuss the kinds of Goods and Service Tax.
- Q.3 Explain the Long-term capital gain and Short-term capital gain. (14)
 OR
- Q.3 Explain the scope of Supply and discuss the composite and mixed Supply.
- Q.4 Explain the deductions available from the computation of Total Income. (14)
 OR
- Q.4 Which expenses, relief and exceptions are deducted while Computation of Income?
- Q.5 Write any two short-notes from the following: (14)
1. "Tax Invoice" under Goods & Service Tax
 2. Assessment under Income Tax Act
 3. E Commerce
 4. Tax deduction from source under Income Tax Act
